



**DL-001-001264**

Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. II) (CBCS) Examination**

**March - 2022**

**Economics : Paper-3 (Elective-1)**

**(Principles of Economics-2)**

**(Old Course)**

**Faculty Code : 001**

**Subject Code : 001264**

Time : **2.30** Hours]

[Total Marks : **70**

1 સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો આકૃતિની મદદથી સમજાવો. તેની ઉપયોગીતા જણાવો. 14

**અથવા**

1 ઉત્પાદન ખર્ચના ખ્યાલો ઉદાહરણ આપી સમજાવી. તેની મર્યાદાઓ જણાવો. 14

2 'ઉત્પાદનના સાધનોનો પુરવઠો સંપૂર્ણ કરતાં ઓછો હોય ત્યારે ભાડું ઉદ્ભવે છે.' 14  
- આકૃતિ દોરી સમજાવો.

**અથવા**

2 ઘટતા મળતરનો નિયમ આકૃતિ દોરી સમજાવો. 14

3 વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો. 14

**અથવા**

3 વૈયક્તિક વહેંચણી અને કાર્યલક્ષી વહેંચણીના ખ્યાલો સમજાવો અને સાધનોના મૂલ્ય નિર્ધારણનો પ્રશ્ન શા માટે અલગથી વિચારવામાં આવે છે ? તેની ચર્ચા કરો. 14

4 'નફો એ નવ પ્રવર્તનનું પરિણામ છે' - સમજાવો. 14

**અથવા**

4 કાચા નફા અને શુદ્ધ નફાનો ખ્યાલ સમજાવી, તેની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 14

5 ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) 14

(1) સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ

(2) આભાસી ભાડું

(3) વધતા મળતરનો નિયમ

(4) વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની મર્યાદાઓ

## ENGLISH VERSION

1 Explain concepts of fixed cost and variable costs with the help of diagram. State its importance. 14

**OR**

1 Explain the concept of production cost with illustration. State its limitations. 14

2 'When the supply of the factors is less than perfectly elastic rent arises' - Explain with diagram. 14

**OR**

2 Explain the law of diminishing return with the help of diagram. 14

3 Explain the marginal productivity theory of distribution. 14

**OR**

3 Explain the concept of personal distribution and functional distribution and discuss why does the issue of price determination of factor of production is separately though ? 14

4 Explain - 'Profits are the reward for innovations.' 14

**OR**

4 Explain the concept of gross profit and net profit, clarify the difference between them. 14

5 Write Short note : (Any Two) 14

(1) Average cost and marginal cost

(2) Quasi Rent

(3) The law of increasing Return

(4) Limitations of the marginal productivity theory of distribution.